

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર

મંડળ દ્વારા સચિવાલયના શ્રમ અને રોજગાર વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા નિયામકશ્રી, રોજગાર અને તાલીમ હસ્તકના જુદા જુદા ટ્રેડના સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર સંવર્ગોની સીધી ભરતીથી ભરવાની જગ્યાઓ ભરવા માટે તા. ૦૭/૦૩/૨૦૧૯ ના રોજ સંયુક્ત જા.ક. ૧૬૭/૨૦૧૮૧૯ થી ૧૮૦/૨૦૧૮૧૯ પ્રસિદ્ધ કરી લાયક ઉમેદવારો પાસેથી ઓન-લાઇન અરજીપત્રકો મંગાવી રજીસ્ટર્ડ થયેલ ઉમેદવારોની ભરતીપ્રક્રિયા હાથ ધરવામાં આવેલ હતી. તે દરમિયાન શ્રી યશ અશ્વિનભાઈ જસાણી નામના અરજદારે મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ ઉક્ત જાહેરાતમાં PM (દિવ્યાંગ) ઉમેદવારો માટેની જે જગ્યાઓ અનામત દર્શાવેલ છે, તે જગ્યાઓ સામે વિકલાંગ ઉમેદવારો ઉપલબ્ધ નહીં થાય તો તેવી જગ્યાઓ સામાન્ય ઉમેદવારોથી ભરવામાં આવશે તે મુજબનો નિર્દેશ કરવામાં આવેલ છે તે સામાન્ય વહીવટ વિભાગનાં તા.૧૫/૦૨/૨૦૦૧ ના ઠરાવની જોગવાઈ વિરુદ્ધ હોવાથી તે રદ કરવાની રજૂઆત સાથે વિકલાંગ વ્યક્તિઓ માટેના કમિશનરશ્રીની કોર્ટમાં ફરિયાદ કરેલ હતી. જે અન્વયે કમિશનરશ્રીએ તા.૨૫/૦૬/૨૦૧૯ના રોજની સુનાવણી સમયે ઉપસ્થિત રહેવા મંડળને નોટીસ મોકલેલ હતી. જે સુનાવણી દરમિયાન મંડળ તરફથી ખ-૧ શાખાના સેક્શન અધિકારીશ્રીએ ઉપસ્થિત રહી સામાન્ય વહીવટ વિભાગના ઉક્ત તા.૧૫/૦૨/૨૦૦૧ ના ઠરાવની જોગવાઈઓનો અમલ જે તે સંવર્ગનું નિયમન કરનાર નિમણૂક સત્તાધિકારીશ્રીએ કરવાનો થાય છે, તેવી રજૂઆત કરતાં વિકલાંગ વ્યક્તિઓ માટેના કમિશનરશ્રીએ તેમના તા. ૦૩/૦૭/૨૦૧૯ ના હુકમથી વિકલાંગ ઉમેદવારો માટેની અનામત જગ્યાઓ જે તે ભરતી પ્રસંગે લાયક ઉમેદવારો ઉપલબ્ધ ન થવાના કારણે ખાલી રહેવા પામે તો તેવી જગ્યાઓને ત્રણ ભરતી પ્રસંગ સુધી આગળ ખેંચવાની જોગવાઈઓનો અમલ જે તે સંવર્ગના નિમણૂક સત્તાધિકારીશ્રીએ કરવાની થતી હોય તો તે મુજબ મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાતમાં તે મુજબ જરૂરી સ્પષ્ટતા માટે જાહેરાતમાં જરૂરી સુધારો બહાર પાડવા માટેના આદેશો કરેલ છે. જે અન્વયે મંડળની ઉક્ત તા. ૦૭/૦૩/૨૦૧૯ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ જા.ક. ૧૬૭/૨૦૧૮૧૯ થી ૧૮૦/૨૦૧૮૧૯ માં નીચે દર્શાવ્યા મુજબનો સુધારો બહાર પાડવામાં આવે છે, જેની સંબંધિત ઉમેદવારોએ જરૂરી નોંધ લેવા આથી જણાવવામાં આવે છે.

સુધારા જાહેરાત

જા.ક. ૧૬૭/૨૦૧૮૧૯ થી ૧૮૦/૨૦૧૮૧૯ - સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર

મંડળ દ્વારા શ્રમ અને રોજગાર વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા નિયામકશ્રી, રોજગાર અને તાલીમ હસ્તકના જુદા જુદા સંવર્ગોની સીધી ભરતીથી ભરવાની જગ્યાઓ માટે તા. ૦૭/૦૩/૨૦૧૯ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ સંયુક્ત જા.ક. ૧૬૭/૨૦૧૮૧૯ થી ૧૮૦/૨૦૧૮૧૯ ના જાહેરાતના પૃષ્ઠ ૫ પર નોંધ: (ડ) માં વર્ણવવામાં આવેલ વિગતો સાથે નીચે દર્શાવ્યા મુજબની વધારાની વિગતો વંચાણે લેવા આથી સુધારો બહાર પાડવામાં આવે છે, જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી.

જાહેરાતના પૃષ્ઠ ૫ પર નોંધ: (૬) માં દર્શાવેલ વિગતો	સુધારા મુજબની વિગતો
<p>(૬) શારીરિક રીતે વિકલાંગ ઉમેદવારોની જગાઓ જે તે કેટેગરી સામે સરભર કરવામાં આવશે. શારીરિક રીતે વિકલાંગ ઉમેદવારોની જગાઓ માટે લાયક શારીરિક રીતે વિકલાંગ ઉમેદવારો નહીં મળે તો તે જગા જે તે કેટેગરીના અન્ય સામાન્ય લાયક ઉમેદવારોથી ભરવામાં આવશે.</p>	<p>(૬) શારીરિક રીતે વિકલાંગ ઉમેદવારોની જગાઓ જે તે કેટેગરી સામે સરભર કરવામાં આવશે. સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગના તા.૧૫/૨/૨૦૦૧ ના ઠરાવ ક્રમાંક: સીઆરઆર-૧૦૨૦૦૦-જી.ઓ.આઇ.૭-ગ.૨ ના મુદ્દા નં. - ૩ (૧) ની જોગવાઈના અમલ માટે વિકલાંગ ઉમેદવારો માટેની જગ્યાઓ માટે પૂરેપૂરા ઉમેદવારો/ આંશિક ઉમેદવારો ઉપલબ્ધ ન થાય તો તેવી જગ્યાઓ જે તે સંવર્ગનું નિયમન કરનાર નિમણૂક સત્તાધિકારીશ્રીએ બીજી ભરતી પ્રસંગ સમયે તેવી જગ્યાઓ આગળ ખેંચીને તેનો ભરવાની થતી જગ્યાઓમાં સમાવેશ કરીને માંગણીપત્રક ભરતી બોર્ડને મોકલવાનું રહેશે.</p>

(૧) જા.ક. ૧૬૭/૨૦૧૮૧૯ થી ૧૮૦/૨૦૧૮૧૯ ના તમામ ઉમેદવારો માટે તા. ૦૭/૦૩/૨૦૧૯ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ મૂળ જાહેરાત તેમજ ત્યારબાદ થયેલ વખતોવખતનાં સુધારામાં વર્ણવ્યા મુજબની અન્ય તમામ સૂચનાઓ અને શરતો યથાવત રહેશે.

સ્થળ:- ગાંધીનગર

સચિવ

તારીખ- ૧૫/૦૭/૨૦૧૯

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ

ગાંધીનગર